



SEAT No. _____

No. of Printed Pages: 2

[A-21(A)]

SARDAR PATEL UNIVERSITY

B.Com. CBCS (SEM – III) Examination – 2022

24th September, 2022 (Saturday)

12.30 P.M. To 2.30 P.M.

UB03ECOM01- Corporate Accounting – III

કુલ ગુણ: ૬૦

નોંધ: જાહેરાત બાજુમાં આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે. બેના પેપર ૮ પ્રશ્નોમાંથી કોઈપણ ૪ પ્રશ્નોના ઉત્તર આપો.

પ્ર.૧	પરિશિષ્ટ VI (૬) મુજબ સુધારેલ પાકું સરવૈયું અંદાજિત આંકડા સહિત તૈયાર કરો.	૧૫																																																																					
પ્ર.૨	બરોડા. લી. કે જે ૧ લી અપ્રિલ ૨૦૨૦ ના રોજ રૂ. ૬,૦૦,૦૦૦ ની શેરમૂડી પ્રતિ શેર રૂ. ૧૦ લેખે સ્થાપિત થઈ હતી. જેમાંથી ૫૨,૦૦૦ શેરનું ભરાણું થયું પણ ૧૦૦ શેરના નાણા બાકી રહ્યા છે. નીચે આપેલ તા. ૩૧.૦૩.૨૦૨૧ ના રોજના કાચા સરવૈયા પરથી નફા નુકશાન ખાતું અને ઉભું પાકું સરવૈયું તૈયાર કરો. <table border="1"> <thead> <tr> <th>વિગત</th><th>ઉધાર રૂ.</th><th>જમા રૂ.</th></tr> </thead> <tbody> <tr> <td>બેંકમાં રોકડ (બેંક સિલક)</td><td>૧૦૫૦૦૦</td><td></td></tr> <tr> <td>શેરમૂડી</td><td></td><td>૫૧૮૭૫૦</td></tr> <tr> <td>યંત્રો</td><td>૪૦૦૦૦</td><td></td></tr> <tr> <td>સીલ્વરનું વેચાણ</td><td></td><td>૧૭૮૫૦૦</td></tr> <tr> <td>ખાણ</td><td>૨૨૦૦૦૦</td><td></td></tr> <tr> <td>વેચાણ વૃદ્ધિ ખર્ચ</td><td>૬૦૦૦</td><td></td></tr> <tr> <td>થાપણાનું વ્યાજ</td><td></td><td>૩૮૦૦</td></tr> <tr> <td>રોકાણોનું ડીવીડન્ડ ૨૨% ટેક્ષ બાદ</td><td></td><td>૩૨૦૦</td></tr> <tr> <td>ચૂકવેલ રોયલ્ટી</td><td>૧૦૦૦૦</td><td></td></tr> <tr> <td>રેલ્વે ટ્રેક અને વેગન</td><td>૧૭૦૦૦</td><td></td></tr> <tr> <td>ખાણની મજૂરી</td><td>૭૪૨૨૦</td><td></td></tr> <tr> <td>જાહેરાત</td><td>૫૦૦૦</td><td></td></tr> <tr> <td>યંત્રોનું ભાડું</td><td>૧૮૦૦</td><td></td></tr> <tr> <td>ફર્નિચર અને મકાન</td><td>૨૦૮૦૦</td><td></td></tr> <tr> <td>વહીવટી ખર્ચો</td><td>૨૮૦૦૦</td><td></td></tr> <tr> <td>મરામત</td><td>૮૦૦</td><td></td></tr> <tr> <td>કોલસો અને ઓઈલ</td><td>૬૫૦૦</td><td></td></tr> <tr> <td>રોકડ</td><td>૫૩૦</td><td></td></tr> <tr> <td>ખાણની કંપનીમાં રોકાણ</td><td>૮૦૦૦૦</td><td></td></tr> <tr> <td>ખાણની કંપનીના શેર ખરીદવાની દલાલી</td><td>૧૫૦૦</td><td></td></tr> <tr> <td>૬% ના દરે સિન્ડિકેટ બેંકમાં થાપણો</td><td>૮૮૦૦૦</td><td></td></tr> <tr> <td>કુલ</td><td>૭૦૬૩૫૦</td><td>૭૦૬૩૫૦</td></tr> </tbody> </table> યંત્રો અને રેલ્વે ટ્રેક અને વેગન પર ૧૦.%, ફર્નિચર અને મકાન પર ૫% લેખે ઘસારો ગણો, તા. ૩૧.૦૩.૨૦૨૧ ના રોજ બરોડા લી. ની કિંમત રૂ. ૧૫,૦૦૦ હતી. (આખર સ્ટોક) તા. ૧૦.૧૨.૨૦૨૦ ના રોજ ડાયરેક્ટરોએ નક્કી કર્યું કે ૧૦૦ શેર કે જેના પર પ્રતિ શેર દીઠ રૂ. ૭.૫૦ લેખે મળેલ રકમ જપ્ત કરી, રૂ. ૨૦,૦૦૦ ની કરવેરાની જોગવાઈ કરી.	વિગત	ઉધાર રૂ.	જમા રૂ.	બેંકમાં રોકડ (બેંક સિલક)	૧૦૫૦૦૦		શેરમૂડી		૫૧૮૭૫૦	યંત્રો	૪૦૦૦૦		સીલ્વરનું વેચાણ		૧૭૮૫૦૦	ખાણ	૨૨૦૦૦૦		વેચાણ વૃદ્ધિ ખર્ચ	૬૦૦૦		થાપણાનું વ્યાજ		૩૮૦૦	રોકાણોનું ડીવીડન્ડ ૨૨% ટેક્ષ બાદ		૩૨૦૦	ચૂકવેલ રોયલ્ટી	૧૦૦૦૦		રેલ્વે ટ્રેક અને વેગન	૧૭૦૦૦		ખાણની મજૂરી	૭૪૨૨૦		જાહેરાત	૫૦૦૦		યંત્રોનું ભાડું	૧૮૦૦		ફર્નિચર અને મકાન	૨૦૮૦૦		વહીવટી ખર્ચો	૨૮૦૦૦		મરામત	૮૦૦		કોલસો અને ઓઈલ	૬૫૦૦		રોકડ	૫૩૦		ખાણની કંપનીમાં રોકાણ	૮૦૦૦૦		ખાણની કંપનીના શેર ખરીદવાની દલાલી	૧૫૦૦		૬% ના દરે સિન્ડિકેટ બેંકમાં થાપણો	૮૮૦૦૦		કુલ	૭૦૬૩૫૦	૭૦૬૩૫૦	૧૫
વિગત	ઉધાર રૂ.	જમા રૂ.																																																																					
બેંકમાં રોકડ (બેંક સિલક)	૧૦૫૦૦૦																																																																						
શેરમૂડી		૫૧૮૭૫૦																																																																					
યંત્રો	૪૦૦૦૦																																																																						
સીલ્વરનું વેચાણ		૧૭૮૫૦૦																																																																					
ખાણ	૨૨૦૦૦૦																																																																						
વેચાણ વૃદ્ધિ ખર્ચ	૬૦૦૦																																																																						
થાપણાનું વ્યાજ		૩૮૦૦																																																																					
રોકાણોનું ડીવીડન્ડ ૨૨% ટેક્ષ બાદ		૩૨૦૦																																																																					
ચૂકવેલ રોયલ્ટી	૧૦૦૦૦																																																																						
રેલ્વે ટ્રેક અને વેગન	૧૭૦૦૦																																																																						
ખાણની મજૂરી	૭૪૨૨૦																																																																						
જાહેરાત	૫૦૦૦																																																																						
યંત્રોનું ભાડું	૧૮૦૦																																																																						
ફર્નિચર અને મકાન	૨૦૮૦૦																																																																						
વહીવટી ખર્ચો	૨૮૦૦૦																																																																						
મરામત	૮૦૦																																																																						
કોલસો અને ઓઈલ	૬૫૦૦																																																																						
રોકડ	૫૩૦																																																																						
ખાણની કંપનીમાં રોકાણ	૮૦૦૦૦																																																																						
ખાણની કંપનીના શેર ખરીદવાની દલાલી	૧૫૦૦																																																																						
૬% ના દરે સિન્ડિકેટ બેંકમાં થાપણો	૮૮૦૦૦																																																																						
કુલ	૭૦૬૩૫૦	૭૦૬૩૫૦																																																																					
પ્ર.૩	નાણાકીય પત્રકો એટલે શું? તેમાંથી બેનું જણાવો. નાણાકીય પત્રકો કોણ માટે ઉપયોગી છે તેની સમજૂતી આપો.	૧૫																																																																					
પ્ર.૪	સામાન્ય માપના પત્રકો અને તુલનાત્મક પત્રકોનું વિશ્લેષણ ની વિસ્તૃત સમજૂતી આપો.	૧૫																																																																					
પ્ર.૫	ટૂંક નોંધ લખો: ૧. હિસાબી ગુણોત્તર ની ઉપયોગિતા ૨. દેવદાર ગુણોત્તર ૩. સ્ટોક ફરબદલ ગુણોત્તર	૧૫																																																																					

પ્ર.કુ	આણંદ લી નું બે વર્ષનું પાકું સરવૈયું નીચે મુજબ છે.	૧૫																																																																		
	<table> <tr> <th>જવાબદારીઓ</th><th>૩૧.૩.૨૦૨૦</th><th>૩૧.૩.૨૦૨૧</th><th>મિલકતો</th><th>૩૧.૩.૨૦૨૦</th><th>૩૧.૩.૨૦૨૧</th></tr> <tr> <td>ઈકિવટી શેર મૂડી</td><td>૧૦૦૦૦૦</td><td>૧૫૦૦૦૦</td><td>જમીન અને મકાન</td><td>૧૦૦૦૦૦</td><td>૮૦૦૦૦</td></tr> <tr> <td>૧૦% પ્રેક્ટ શેર મૂડી</td><td>૫૦૦૦૦</td><td>૫૦૦૦૦</td><td>મશીન</td><td>૮૦૦૦૦</td><td>૮૦૦૦૦</td></tr> <tr> <td>સામાન્ય અનામત</td><td>૩૦૦૦૦</td><td>૩૦૦૦૦</td><td>દેવાદારો</td><td>૫૩૦૦૦</td><td>૩૦૦૦૦</td></tr> <tr> <td>ન. નું ખાતું</td><td>૨૦૦૦૦</td><td>-----</td><td>લેણી હુડીઓ</td><td>૨૦૦૦૦</td><td>૧૨૦૦૦</td></tr> <tr> <td>૧૨% ના ડિબેન્ચર</td><td>૧૦૦૦૦૦</td><td>૫૦૦૦૦</td><td>સ્ટોક</td><td>૭૫૦૦૦</td><td>૮૦૦૦૦</td></tr> <tr> <td>લેણદારો</td><td>૩૦૦૦૦</td><td>૩૫૦૦૦</td><td>બેંક સિલક</td><td>૧૫૦૦૦</td><td>૩૫૦૦૦</td></tr> <tr> <td>દેવી હુડીઓ</td><td>૧૦૦૦૦</td><td>૨૫૦૦૦</td><td>રોકડ સિલક</td><td>૨૦૦૦</td><td>૧૩૦૦૦</td></tr> <tr> <td>બેંક ઓવરડ્રાફ્ટ</td><td>૧૦૦૦૦</td><td>૨૦૦૦૦</td><td>ન. નું ખાતું</td><td>-----</td><td>૧૦૦૦૦</td></tr> <tr> <td>બાકી ખર્ચ</td><td>૫૦૦૦</td><td>૧૦૦૦૦</td><td></td><td></td><td></td></tr> <tr> <td></td><td>૩૫૫૦૦૦</td><td>૩૭૦૦૦૦</td><td></td><td>૩૫૫૦૦૦</td><td>૩૭૦૦૦૦</td></tr> </table>	જવાબદારીઓ	૩૧.૩.૨૦૨૦	૩૧.૩.૨૦૨૧	મિલકતો	૩૧.૩.૨૦૨૦	૩૧.૩.૨૦૨૧	ઈકિવટી શેર મૂડી	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	જમીન અને મકાન	૧૦૦૦૦૦	૮૦૦૦૦	૧૦% પ્રેક્ટ શેર મૂડી	૫૦૦૦૦	૫૦૦૦૦	મશીન	૮૦૦૦૦	૮૦૦૦૦	સામાન્ય અનામત	૩૦૦૦૦	૩૦૦૦૦	દેવાદારો	૫૩૦૦૦	૩૦૦૦૦	ન. નું ખાતું	૨૦૦૦૦	-----	લેણી હુડીઓ	૨૦૦૦૦	૧૨૦૦૦	૧૨% ના ડિબેન્ચર	૧૦૦૦૦૦	૫૦૦૦૦	સ્ટોક	૭૫૦૦૦	૮૦૦૦૦	લેણદારો	૩૦૦૦૦	૩૫૦૦૦	બેંક સિલક	૧૫૦૦૦	૩૫૦૦૦	દેવી હુડીઓ	૧૦૦૦૦	૨૫૦૦૦	રોકડ સિલક	૨૦૦૦	૧૩૦૦૦	બેંક ઓવરડ્રાફ્ટ	૧૦૦૦૦	૨૦૦૦૦	ન. નું ખાતું	-----	૧૦૦૦૦	બાકી ખર્ચ	૫૦૦૦	૧૦૦૦૦					૩૫૫૦૦૦	૩૭૦૦૦૦		૩૫૫૦૦૦	૩૭૦૦૦૦	
જવાબદારીઓ	૩૧.૩.૨૦૨૦	૩૧.૩.૨૦૨૧	મિલકતો	૩૧.૩.૨૦૨૦	૩૧.૩.૨૦૨૧																																																															
ઈકિવટી શેર મૂડી	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	જમીન અને મકાન	૧૦૦૦૦૦	૮૦૦૦૦																																																															
૧૦% પ્રેક્ટ શેર મૂડી	૫૦૦૦૦	૫૦૦૦૦	મશીન	૮૦૦૦૦	૮૦૦૦૦																																																															
સામાન્ય અનામત	૩૦૦૦૦	૩૦૦૦૦	દેવાદારો	૫૩૦૦૦	૩૦૦૦૦																																																															
ન. નું ખાતું	૨૦૦૦૦	-----	લેણી હુડીઓ	૨૦૦૦૦	૧૨૦૦૦																																																															
૧૨% ના ડિબેન્ચર	૧૦૦૦૦૦	૫૦૦૦૦	સ્ટોક	૭૫૦૦૦	૮૦૦૦૦																																																															
લેણદારો	૩૦૦૦૦	૩૫૦૦૦	બેંક સિલક	૧૫૦૦૦	૩૫૦૦૦																																																															
દેવી હુડીઓ	૧૦૦૦૦	૨૫૦૦૦	રોકડ સિલક	૨૦૦૦	૧૩૦૦૦																																																															
બેંક ઓવરડ્રાફ્ટ	૧૦૦૦૦	૨૦૦૦૦	ન. નું ખાતું	-----	૧૦૦૦૦																																																															
બાકી ખર્ચ	૫૦૦૦	૧૦૦૦૦																																																																		
	૩૫૫૦૦૦	૩૭૦૦૦૦		૩૫૫૦૦૦	૩૭૦૦૦૦																																																															

	વધારાની માહિતી: <table> <tr> <th>વિગત</th><th>૩૧.૩.૨૦૨૦ (રૂ.)</th><th>૩૧.૩.૨૦૨૧ (રૂ.)</th></tr> <tr> <td>વેચાણ</td><td>૩૬૫૦૦૦</td><td>૨૧૮૦૦૦</td></tr> <tr> <td>વેચાયેલા માલની કિંમત</td><td>૨૧૮૦૦૦</td><td>૧૪૬૦૦૦</td></tr> <tr> <td>ચોખ્ખો નફો (ડિવિડન્ડ પહેલાં)</td><td>૩૫૦૦૦</td><td>૪૭૫૦૦</td></tr> <tr> <td>સ્ટોક (૧.૪.૨૦૨૦)</td><td>૭૧૦૦૦</td><td>-----</td></tr> </table> ઉપરની માહિતી પરથી નીચેના હિસાબી ગુણોતરની ગણતરી કરો. - ચાલુ ગુણોતર - પ્રવાહી ગુણોતર - દેવાદાર ગુણોતર (૩૬૫ દિવસ) - કાચો નફો ગુણોતર - સ્ટોક ફેરબદલી ગુણોતર	વિગત	૩૧.૩.૨૦૨૦ (રૂ.)	૩૧.૩.૨૦૨૧ (રૂ.)	વેચાણ	૩૬૫૦૦૦	૨૧૮૦૦૦	વેચાયેલા માલની કિંમત	૨૧૮૦૦૦	૧૪૬૦૦૦	ચોખ્ખો નફો (ડિવિડન્ડ પહેલાં)	૩૫૦૦૦	૪૭૫૦૦	સ્ટોક (૧.૪.૨૦૨૦)	૭૧૦૦૦	-----	
વિગત	૩૧.૩.૨૦૨૦ (રૂ.)	૩૧.૩.૨૦૨૧ (રૂ.)															
વેચાણ	૩૬૫૦૦૦	૨૧૮૦૦૦															
વેચાયેલા માલની કિંમત	૨૧૮૦૦૦	૧૪૬૦૦૦															
ચોખ્ખો નફો (ડિવિડન્ડ પહેલાં)	૩૫૦૦૦	૪૭૫૦૦															
સ્ટોક (૧.૪.૨૦૨૦)	૭૧૦૦૦	-----															

પ્ર.કુ	અમુલ લી. ભાગીદારી પેઢીનો ધંધો તા. ૧.૧.૨૦૨૧થી ખરીદી લેવા માટે તા. ૧.૫.૨૦૨૧ના રોજ નોંધવામાં આવી હતી. તા. ૩૧.૧૨.૨૦૨૧ના રોજ પુરા થતા વર્ષના હિસાબો નીચે મુજબની હકીકતો પૂરી પાડે છે: (૧) તા. ૩૧.૧૨.૨૦૨૧ના રોજ પુરા થતા આખા વર્ષનું વેચાણ રૂ. ૮૬૦૦૦૦૦ છે, જે પૈકી રૂ. ૧૬૦૦૦૦૦ તા. ૧.૧.૨૦૨૧થી તા. ૧.૫.૨૦૨૧ સુધીના સમયનું છે. (૨) વેપાર ખાતું કાચો નફો રૂ. ૩૮૪૦૦૦૦ બતાવે છે. (૩) નફા નુકસાન ખાતામાં નીચેની રકમનો સમાવેશ થાય છે: ડિસ્કન્ટરોને ફી રૂ. ૬૦૦૦૦, ઓડીટરોની ફી રૂ. ૩૦૦૦૦, ભાડું વેરા વગેરે રૂ. ૧૮૨૦૦૦, કર્મચારીઓનો પગાર રૂ. ૪૮૦૦૦૦, ધાલ ખાધ રૂ. ૮૦૦૦૦ (રૂ. ૨૮૦૦૦ તા. ૧.૫.૨૦૨૧ પહેલાંના સમયની હતી), ડિબેન્ચરોનું વ્યાજ રૂ. ૨૪૦૦૦૦, યંત્રો અને મશીનરી પરનો ધસારો ૧૪૪૦૦૦, સ્થાપના ખર્ચ રૂ. ૮૬૦૦૦, સામાન્ય ખર્ચ રૂ. ૭૨૦૦૦, વેચાણ પર કમિશન ૧૪૪૦૦૦ અને છપામણી અને સ્ટેશનરી ખર્ચ રૂ. ૮૬૦૦૦. ઉપરની વિગતોને આધારે (૧) સ્થાપના પહેલાનો નફો તથા (૨) સ્થાપના પછીનો નફો શોધો.	૧૫
--------	--	----

પ્ર.કુ	નીતા લી. એ વિમલ ટ્રેડર્સ નો ધંધો તા. ૧.૧૧.૨૦૨૦થી ખરીદી લેવા માટે તા. ૧.૩.૨૦૨૧ના રોજ નોંધવામાં આવી હતી. નીચે ની વિગતો ને આધારે ૩૧.૧૦.૨૦૨૧ ના રોજ પુરા થતા વર્ષના સ્થપના પહેલાનો અને સ્થાપના પછીનો નફો શોધો . (૧) આખા વર્ષનું વેચાણ રૂ. ૬૦૦,૦૦૦ (જેની અંદર રૂ. ૨૫૦૦૦૦ વેચાણ તા. ૧.૩.૨૦૨૧ સુધીના સમયનું છે). (૨) વેપાર ખાતું કાચો નફો રૂ. ૨૧૦૦૦૦ બતાવે છે. (૩) નવર્ષ દરમિયાન ખર્ચ નીચે મુજબ છે: <table> <tr> <th>વિગત</th><th>રૂ.</th><th>વિગત</th><th>રૂ.</th></tr> <tr> <td>જાહેરાત</td><td>૧૮૦૦૦</td><td>ધસારો</td><td>૩૬૬૦૦</td></tr> <tr> <td>ભાડું</td><td>૮૦૦૦</td><td>ઓડીટરોની ફી</td><td>૧૫૦૦</td></tr> <tr> <td>પગાર</td><td>૧૫૦૦૦</td><td>છપામણી અને સ્ટેશનરી</td><td>૩૬૦૦</td></tr> <tr> <td>સામાન્ય ખર્ચ</td><td>૪૮૦૦</td><td>વેચાણ પર કમિશન</td><td>૬૦૦૦</td></tr> <tr> <td>ડિબેન્ચર વ્યાજ</td><td>૫૦૦૦</td><td>ધાલ ખાધ (૩૫૦૦૦ નોંધાવી પછી)</td><td>૧૫૦૦</td></tr> <tr> <td>ડાયરેક્ટર ફી</td><td>૪૮૦૦</td><td>ખરીદ કિંમત પર વ્યાજ (૧.૫.૨૦૨૧ સુધી)</td><td>૩૦૦૦</td></tr> <tr> <td>વેચાણ પર વટાવ</td><td>૩૬૦૦</td><td></td><td></td></tr> </table>	વિગત	રૂ.	વિગત	રૂ.	જાહેરાત	૧૮૦૦૦	ધસારો	૩૬૬૦૦	ભાડું	૮૦૦૦	ઓડીટરોની ફી	૧૫૦૦	પગાર	૧૫૦૦૦	છપામણી અને સ્ટેશનરી	૩૬૦૦	સામાન્ય ખર્ચ	૪૮૦૦	વેચાણ પર કમિશન	૬૦૦૦	ડિબેન્ચર વ્યાજ	૫૦૦૦	ધાલ ખાધ (૩૫૦૦૦ નોંધાવી પછી)	૧૫૦૦	ડાયરેક્ટર ફી	૪૮૦૦	ખરીદ કિંમત પર વ્યાજ (૧.૫.૨૦૨૧ સુધી)	૩૦૦૦	વેચાણ પર વટાવ	૩૬૦૦			૧૫
વિગત	રૂ.	વિગત	રૂ.																															
જાહેરાત	૧૮૦૦૦	ધસારો	૩૬૬૦૦																															
ભાડું	૮૦૦૦	ઓડીટરોની ફી	૧૫૦૦																															
પગાર	૧૫૦૦૦	છપામણી અને સ્ટેશનરી	૩૬૦૦																															
સામાન્ય ખર્ચ	૪૮૦૦	વેચાણ પર કમિશન	૬૦૦૦																															
ડિબેન્ચર વ્યાજ	૫૦૦૦	ધાલ ખાધ (૩૫૦૦૦ નોંધાવી પછી)	૧૫૦૦																															
ડાયરેક્ટર ફી	૪૮૦૦	ખરીદ કિંમત પર વ્યાજ (૧.૫.૨૦૨૧ સુધી)	૩૦૦૦																															
વેચાણ પર વટાવ	૩૬૦૦																																	